

1. મોહેં-જો-દડો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મોહેં-જો-દડોના મકાનોના દરવાજા જાહેર રસ્તાના બદલે અંદરની ગલીમાં પડતાં હતાં.

2. મકાનો પૂર અને ભેજથી બચવા પર્વત ઉપર બાંધેલાં હતાં.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

~~(D)~~ બંનેમાંથી એક પણ નહિ

2. મગધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પ્રારંભમાં રાજગ્રીહ મગધની રાજધાની હતું, જેનું આધુનિક નામ રાજગીર છે.

2. પછીથી પાટલિપુત્ર મગધની રાજધાની બન્યું જેનું આધુનિક નામ પટણા છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ (C) 1 અને 2 બંને

~~(D)~~ બંનેમાંથી એક પણ નહિ

3. ગિરનારના સુદર્શન તળાવ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આ તળાવનું નિર્માણ મૌર્યકાળમાં સ્થાનિક રાજ્યપાલ દ્વારા કરાયું હતું.

2. સમ્રાટ અશોકે તેનું સમારકામ કરાવ્યું હતું.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ (C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ



4. બૌદ્ધ દર્શન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બૌદ્ધ ધર્મની પ્રારંભિક પરંપરામાં ભગવાનનું અસ્તિત્વ ખૂબ જ મહત્વનું હતું.
2. બૌદ્ધ દર્શન મુજબ જગત અનિત્ય અને પરિવર્તનશીલ છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

5. ભારતની ભક્તિ પરંપરા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સગુણ પરંપરામાં અમૂર્ત નિરાકર ઈશ્વરની ઉપાસના કરવામાં આવતી હતી.
2. નિર્ગુણ પરંપરામાં શિવ, વિષ્ણુ અને તેમના અવતારો તથા દેવીઓની આરાધના કરવામાં આવતી હતી.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

☒ (B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

6. મીરાંબાઈ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મીરાંબાઈ મૂળ દ્વારકાનાં હતાં.
2. તેમણે વિષ્ણુના અવતાર કૃષ્ણને પોતાના એક માત્ર પતિ તરીકે સ્વીકાર્યા.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

☒ (B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

7. બંગાળના ભાગલા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. 1905 માં બંગાળ પ્રાંતના ભાગલા કરવામાં આવ્યા.
2. તેનાં વિરોધમાં અસહકાર આંદોલન શરૂ કરવામાં આવ્યું.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

8. ગોળમેજી પરિષદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી હતી પણ કોંગ્રેસની ગેરહાજરીને કારણે નિષ્ફળ ગઈ.
2. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી હાજર રહ્યા પણ અલગ અલગ મતદારમંડળના વિભાજનકારી મુદ્દાને કારણે નિષ્ફળ ગઈ.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

9. 'હિન્દ છોડો ચળવળ' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મુંબઈમાં મળેલી કોંગ્રેસની બેઠકમાં 8મી ઓગસ્ટ, 1942ની રાતે 'હિન્દ છોડો'નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
2. 'હિન્દ છોડો ચળવળ'નું સૂત્ર 'કરેંગે યા મરેંગે' હતું

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

10. આઝાદ હિન્દ ફોજ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેની સ્થાપના અસ્થાયી રીતે રાસબિહારી બોઝ અને કેપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી.
 2. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજના વડા તરીકે રાસબિહારી બોઝની નિમણૂક કરી.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ (C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

11. હિન્દ સ્વાતંત્ર્યધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

- ☒ 1. વાઈસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે 1947માં આ ધારો પસાર કર્યો.
- ☒ 2. આ ધારા મુજબ પાકિસ્તાને પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને પસંદ કર્યા.
- ☒ 3. ગાંધીજી આ ધારાને 'બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એક માત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો' કહ્યો.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 1 અને 3

☒ (C) ફક્ત 2 અને 3

☒ (D) 1, 2 અને 3

12. 'ઓપરેશન વિજય' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન છે.

2. તેની આગેવાની જનરલ માણેકશાએ કરી હતી.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

C

13. ધાર્મિક માન્યતા પ્રમાણે નીચેનામાંથી કયાં પક્ષી/પ્રાણીઓને દેવ-દેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે?

૧. વાઘ

૨. મોર

૩. મગર

૪. સિંહ

૫. કોયલ

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 1, 3 અને 5

☒ (C) ફક્ત 1, 2, 3 અને 5

(D) 1, 2, 3, 4 અને 5

14. ભારતીય કલા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. કાષ્ઠકલામાં ઇસરના રમકડાં જાણીતાં છે.

2. રાજસ્થાનનું બિકાનેર ધરેણાના જડતરકામ (inlay work) માટે જાણીતું છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

15. ભારતીય સંગીતકલા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. અલ્લાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનના કારણે 'તુતી-એ-હિન્દ' તરીકે વિખ્યાત થયા.

2. સ્વામી રામદાસના શિષ્ય બૈજુ બાવરા થઈ ગયા.

3. બૈજુ બાવરાના સમયમાં ગુજરાતમાં તાના અને રીરી બહેનોની બેલડી હતી.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 2 અને 3

☒ (C) ફક્ત 1 અને 3

(D) 1, 2 અને 3

16. નીચે આપેલાં નૃત્યો અને નૃત્યકારોના જોડકાંને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નૃત્યકાર	નૃત્ય
1. મૃણાલિની સારાભાઈ.	a. કુચિપુડી
2. શોભા નાયડુ	b. કથક
3. શિવરામન	c. ભરતનાટ્યમ 1-C
4. સિતારા દેવી	d. કથકલી

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

	1	2	3	4
(A)	d	b	c	a
(B)	c	a	d	b
(C)	b	d	a	c
(D)	d	a	b	c

17. રાંદલમાતા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાંદલ એ માતૃત્વનાં દેવી છે.
 2. એ સૂર્યનાં અર્ધાંગીની છે, અને તેમનું વાહન ઘોડો છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
- (B) ફક્ત 2
- (C) 1 અને 2 બંને
- (D) બંનેમાંથી એક પણ નહિ

18. ભાડભૂતના મેળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક શ્રાવણ મહિનામાં આ મેળો ભરાય છે.
 2. ભાડભૂત ગુજરાતનાં ભરૂચ જિલ્લામાં આવેલું છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
- ~~(B)~~ ફક્ત 2
- ~~(C)~~ 1 અને 2 બંને
- (D) બંનેમાંથી એક પણ નહિ

C

19. ભારતીય સ્થાપત્ય જોવા વિશે નીચેના સંવાદો ધ્યાને લો:

1. વિરાટ કોહલી: પહેલી T20 આગ્રામાં છે એટલે હું લાલ કિલ્લો જોવા જઈશ.
2. રોહિત શર્મા: આપણે તાજમહેલ જોવા પણ જઈશું.
3. યશસ્વી જયસવાલ: મારે ત્યાં બુલંદ દરવાજો જોવો છે, મને સાથે લઈ જાઓ.
4. પ્રસાદ: બુલંદ દરવાજો જોવા તો હૈદરાબાદ જવું પડે.

ઉપર પૈકી કયા સંવાદો સાચા છે?

- (A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 1 અને 4
(C) ફક્ત 1, 3 અને 4
(D) ફક્ત 1 અને 2

20. બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બંધારણીય જોગવાઈઓને આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે.
2. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ.
3. કાયદાઓ બંધારણથી સર્વોપરી છે.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

- (A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3

21. ભારતીય બંધારણના આમુખમાં નીચેનામાંથી કયું સમાવિષ્ટ કરવામાં આવ્યું છે?

સત્યમેવ જયતે

- સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

- (A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ

22. 42મા બંધારણીય સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આમુખમાં "સમાજવાદી" "બિનસાંપ્રદાયિક" શબ્દો ઉમેરવામાં આવ્યા.
2. 'રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા' નો પણ આમુખમાં સમાવેશ કરવામાં આવ્યો.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ

23. નીચેનામાંથી કયા વિષયો સંઘ (કેન્દ્ર) અને રાજ્યોની સંયુક્ત યાદીમાં છે?

- ✓ 1. કાયદો અને વ્યવસ્થા
2. દિવાની અને ફોજદારી બાબતો
3. નાણું

✓ 4. આર્થિક આયોજન

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

✗ (A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 2 અને 3

(C) ફક્ત 1 અને 3

(D) ફક્ત 2 અને 4

24. રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

✓ 1. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે તે રાજ્યમાં કેન્દ્રિય અનામત પોલીસદળોને મોકલી શકે.

✗ 2. કેન્દ્ર રાજ્યની મરજી વિરુદ્ધ જઈને તે રાજ્યમાં કેન્દ્રિય અનામત પોલીસદળોને મોકલી શકે નહીં.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

✓ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

25. નાણાકીય સાધનોની વહેંચણી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આબકારી જકાત, આયાત-નિકાસ જકાત, આવકવેરો જેવાં વધુ આવક આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે.

2. વેચાણવેરો, મનોરંજનવેરો, જમીન મહેસૂલ, શિક્ષણવેરો જેવા ઓછી આવક આપતા કરવેરા રાજ્યોને ફાળવવામાં આવ્યા છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

✓ (D) બંનેમાંથી એક પણ નહિ

26. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

- (A) માંગનો નિયમ અન્ય પરિબલોને ક્ષેત્ર રાખીને વસ્તુની કિંમત અને તેના માંગેલા જથ્થા વચ્ચેના સંબંધની તપાસ કરે છે.
 (B) પુરવઠાનો નિયમ અન્ય પરિબલોને ક્ષેત્ર રાખીને વસ્તુની કિંમત અને તેના પૂરા પાડવામાં આવેલ જથ્થા વચ્ચેના સંબંધની તપાસ કરે છે.
 (C) ચિકન વસ્તુ ની કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે
 (D) ગ્રાહકની આવક અને ફલકી વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે.

27. પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RREBs) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. RREBની દેખરેખ NABARD દ્વારા કરવામાં આવે છે.
 2. RREBs એ RBI દ્વારા નિર્ધારિત નિયમનકારી ધોરણોનું પાલન કરવું પડે છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

28. NABARD વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. NABARDની રચના ડેલકર સમિતિની ભલામણથી કરવામાં આવી હતી.
2. NABARD ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ચિરામ પ્રદાન કરતી સંસ્થાઓ માટે સર્વોચ્ચ ચિરામ એજન્સી તરીકે સેવા આપે છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

29. નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પ્રગતિશીલ પ્રત્યક્ષ કરનો એક હેતુ આવકની અસમાનતા ઘટાડવાનો છે.
2. પરોક્ષ કરનો બોજ પ્રમાણમાં ગરીબ લોકો પર વધુ પડે છે.
3. સંપત્તિ વેરો એ પ્રત્યક્ષ કર છે જ્યારે આયાત જકાત એ પરોક્ષ કર છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 1 અને 3

(C) ફક્ત 2 અને 3

(D) 1, 2 અને 3

30. કોમ્પિટિશન એક્ટ-2002 વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ કાયદાનો ઉદ્દેશ સ્પર્ધા વિરોધી પ્રથાઓને રોકવા અને પૈકીઓ વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે.
 2. આ કાયદો જોડાણોને પ્રતિબંધિત કરતો નથી પરંતુ તેનું નિયમન કરે છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
- (A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અને 2 બંને (D) બંનેમાંથી એક પણ નહિ
31. નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. વ્યાજની ચુકવણી પરના જાહેર ખર્ચને વિકાસલક્ષી ખર્ચ ગણવામાં આવે છે.
 2. રણ વિસ્તારમાં સિંચાઈ નેટવર્ક બાંધવા માટેનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ તરીકે ગણવામાં આવે છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
- (A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અને 2 બંને (D) બંનેમાંથી એક પણ નહિ
32. નીચેના વિધાનોને ધ્યાને લો:
1. પૂર્ણ હરીફાઈમાં ખરીદદારો પાસે પસંદગી होती નથી.
 2. ઇજારાદાર પેઢી પાસે કિંમત પર સંપૂર્ણ નિયંત્રણ હતું નથી.
 3. ઇજારામુક્ત હરીફાઈમાં વસ્તુવેવિધ્ય જોવા મળે છે.
- ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
- (A) ફક્ત 1 અને 2 (B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3 (D) 1, 2 અને 3
33. અર્થવ્યવસ્થાના માળખામાં ફેરફારના સંદર્ભમાં નીચેનામાંથી કયું શ્રેષ્ઠ રીતે ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશન (deindustrialization)ને વ્યાખ્યાયિત કરે છે?
- (A) કુલ રોજગારના હિસ્સા તરીકે ઉત્પાદનના રોજગારમાં ઘટાડો
(B) અર્થતંત્રમાં મોટાપાયાના સાહસોની સંખ્યામાં ઘટાડો
(C) અર્થતંત્રમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યામાં ઘટાડો
(D) ઔદ્યોગિક ક્ષેત્રની અંદર લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓનો ઘટાડો

34. નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ચીન સાથે ભારતનો વેપાર ખાતુ પુરાન્તમાં છે.

2. ભારે મશીનરી અને સોનું ભારતની મુખ્ય નિકાસની ચીજવસ્તુઓ છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

35. ભારતમાં સમવાયી નાણાતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

(A) સંસાધનોની હેરફેર કેન્દ્ર સરકારથી રાજ્ય સરકારોને થાય છે.

(B) નીતિ આયોગ સંસાધનોની હેરફેર અંગે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

(C) સમસ્તરીય હેરફેર એ ભારતના વિવિધ રાજ્યો વચ્ચે સંસાધનોના વિતરણનો સંદર્ભ આપે છે.

☒ (D) રાજ્યની વસ્તી અને વનવિસ્તાર, અન્ય પરિબલોની સાથે સમસ્તરીય વિભાજન નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

36. ગુજરાત રાજ્યના સ્થાન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં હિન્દ મહાસાગરને કિનારે આવેલું છે.

2. તેનો મોટો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ (C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ.

37. 'રેગુર' જમીન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

☒ 1. બેસાલ્ટના વિઘટનથી 'રેગુર' જમીન બને છે.

2. જે કપાસના પાક માટે ઉત્તમ છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

38. ચરોતર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેની રચના મહી, શેહી અને વાતક જેવી નદીઓને નિર્દોષ કરેલા કાંપથી થઈ છે.
2. આ મેદાન લોએસ પ્રકારની બેસર જમીનનું બનેલું છે.
3. આ જમીન શેરડીના પાક માટે ઉત્તમ ગણાય છે.

ઉપર પૈકી કયાં વિધાનો સાચા છે?

- (A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3

39. દરિયાકાંઠે ચેર આચ્છાદિત વિસ્તાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ચેર આચ્છાદિત વિસ્તારો ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરબનમાં આવેલા છે.
2. ગુજરાતમાં ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર વાલસાડ જિલ્લામાં આવેલો છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ

40. ગંગા નદી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તે ગંગોત્રીમાંથી નીકળે છે ત્યારે ભાગીરથી નામે ઓળખાય છે.
 2. દેવપ્રયાગમાં ભાગીરથીને અલકનંદા મળે છે પછી ગંગા નામે ઓળખાય છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ

41. અલ-બિનો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. અલ-બિનો એક જટિલ રુતુ તંત્ર છે.
 2. તેનાથી જુદાજુદા ભાગોમાં દુઝળ, પૂર વગેરે આવે છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ

C

42. 'કાલ વૈશાખી' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે અસમ અને પશ્ચિમ બંગાળમાં આવતી સ્થાનિક આંધી છે.
 2. તે વૈશાખ મહિનાની સાંજે વાતા ભયંકર, વિનાશકારી વરસાદયુક્ત પવનો છે.
 3. અસમમાં આ આંધીને 'બારદોલી છીડા' કહે છે.
- ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

- (A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3

43. જંગલોના પ્રકાર ને મુખ્ય વૃક્ષોના નીચે આપેલાં જોડકાંને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો:

- | જંગલનો પ્રકાર | વૃક્ષો |
|--------------------------------|---------------------------|
| 1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો | a. સાગ, સાલ, સિસમ |
| 2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો | b. સુંદરી, ચેર |
| 3. ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો | c. મેહગોની, અબનૂસ, રોઝવુડ |
| 4. ભરતીનાં જંગલો | d. બાવળ, ખીજડો |

	1	2	3	4
(A)	d	b	c	a
(B)	c	a	d	b
(C)	b	d	a	c
(D)	d	a	b	c

44. ગુજરાતમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) રેડ ડેટા બુક મુજબ નીચેનામાંથી કઈ વનસ્પતિને ભંય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે?

- | | |
|---------------|---------|
| 1. સફેદ ખાખરો | 2. ગુગળ |
| 3. આમળી | 4. હરડે |

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

- (A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2 અને 4
(D) ફક્ત 1

45. ભારતમાં વન્ય જીવસૃષ્ટિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
 1. જમ્મુ-કાશ્મીરના ગીચ વનવિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે.
 2. પશ્ચિમઘાટના વનવિસ્તારોમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે છે.
 ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
 (A) ફક્ત 1
 (B) ફક્ત 2
 (C) 1 અને 2 બંને
 (D) બંનેમાંથી એક પણ નહિ
46. નીચેનામાંથી કયાં પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે?
 1. એશિયાઈ સિંહ
 2. ઘુડખર
 3. પદ્મવાળી ગરોળી
 નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 (A) 1, 2 અને 3
 (B) ફક્ત 1 અને 3
 (C) ફક્ત 1 અને 2
 (D) ફક્ત 1
47. નીચેનામાંથી દક્ષિણ ભારતનાં કયું/કયાં રાજ્ય/રાજ્યોને દરિયાકિનારો નથી?
 1. આંધ્રપ્રદેશ
 2. તેલંગાણા
 3. કર્ણાટક
 4. તામિલનાડુ
 નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 (A) ફક્ત 1
 (B) ફક્ત 1 અને 2
 (C) ફક્ત 2 અને 3
 (D) ફક્ત 2
48. ભારતની વસ્તીગીચતા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
 1. 2011ની વસ્તીગણતરી અનુસાર સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય દિલ્હી છે.
 2. 2011ની વસ્તીગણતરી અનુસાર સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે.
 ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
 (A) ફક્ત 1
 (B) ફક્ત 2
 (C) 1 અને 2 બંને
 (D) બંનેમાંથી એક પણ નહિ

C

49. ભારતમાં ધાર્મિક સમુદાય વસ્તીની ટકાવારી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. 2011ની વસ્તીગણતરી અનુસાર હિન્દુ ધર્મ પાળતા લોકોની સૌથી વધુ ટકાવારી હિમાચલ પ્રદેશમાં છે.
2. 2011ની વસ્તીગણતરી અનુસાર મુસ્લિમ ધર્મ પાળતા લોકોની સૌથી વધુ ટકાવારી લક્ષ્મીપ્રમાં છે.
3. 2011ની વસ્તીગણતરી અનુસાર ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોની સૌથી વધુ ટકાવારી નાગાલેંડમાં છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3

50. આફ્રિકા ખંડ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આફ્રિકા ખંડ એશિયા પછી બીજા ક્રમે મોટો ખંડ છે.
2. આફ્રિકા ખંડમાં દુનિયાનું સૌથી મોટું રણ સહારા આવેલું છે અને દુનિયાની સૌથી લાંબી નદી વહે છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ

51. ભારતીય સમવાયતંત્ર નીચેનામાંથી કઈ કટોકટી વખતે સ્થગિત થઈ જાય છે?

1. રાષ્ટ્રિય કટોકટી
2. બંધારણીય કટોકટી
3. નાણાકીય કટોકટી

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

- (A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3

52. ભારતમાં સમવાયતંત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ભારતના બંધારણના આમુખમાં સમવાય (ફેડરલ) શબ્દનો ઉપયોગ/ઉલ્લેખ થયો છે.
 2. ભારતમાં મજબૂત કેંદ્રવાળું અર્ધ સમવાયતંત્ર છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

53. બંધારણમાં સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બધી જ જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતીથી જ સુધારો કરી શકાય છે.

2. અમુક જોગવાઈઓમાં સંસદનાં બંને ગૃહોના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે.

3. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદનાં બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર અને મત આપતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

☒ (B) ફક્ત 2 અને 3

(C) ફક્ત 1 અને 3

(D) 1, 2 અને 3

54. નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. 10 મી ડિસેમ્બરને 'માનવ હક દિન' તરીકે ઉજવવામાં આવે છે.

2. ભારતમાં છઠ્ઠી જાન્યુઆરીને 'મૂળભૂત ફરજ દિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

55. ધારાસભા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. જ્યાં ધારાસભા બે ગૃહોની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાગૃહ (bicameral legislature) કહે છે.

2. ગુજરાતમાં દ્વિગૃહી ધારાસભા છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

C

56. નિર્ણાયક મત (કાસ્ટિંગ વોટ) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ગૃહમાં મતદાન વખતે તરફેણ કે વિરુદ્ધમાં સરખા મત પડ્યા હોય ત્યારે ગૃહના અધ્યક્ષ નિર્ણાયક મત (કાસ્ટિંગ વોટ) આપી શકે છે.

2. સંસદીય સચિવને પણ આવો અધિકાર મળેલો છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

57. ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.

2. અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

58. ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું નીચેનામાંથી કોને સોંપે છે?

(A) વડાપ્રધાનને

(B) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને

(C) એટર્ની જનરલને

☒ (D) ઉપરાષ્ટ્રપતિને

59. રાજ્યપાલ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે.

2. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

☒ (A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

Contd.



Scanned with OKEN Scanner

60. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા પંચાયતના પ્રમુખ છે.
 2. મહાનગર પાલિકાના વહીવટી પાંખના વડા મેયર છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

☒ (B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

61. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સેવા બજાવી હોય.
 2. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોવો જોઈએ.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

☒ (D) બંનેમાંથી એક પણ નહિ

62. લીલા એક મહિનાના પાંચમા દિવસે નવી વર્કઆઉટ રૂટિન શરૂ કરે છે, જે સોમવારે આવે છે. તેણી તે જ મહિનાના 21મા દિવસ પછીના ત્રીજા દિવસે વિરામ લેવાનું આયોજન કરે છે. તેણી કયા દિવસે વિરામ લેશે?

(A) બુધવાર

(B) શુક્રવાર

(C) શનિવાર

(D) સોમવાર

63. નીચેના ગાણિતિક સમીકરણોમાં, જો 'x' ને '÷' સાથે અને '÷' ને 'x' સાથે અદલાવદલી કરવામાં આવે, તો કયું સમીકરણ સાચું હશે?

(A) $36 \times 12 \div 63 = 48$

(B) $72 \div 11 \times 66 = 24$

(C) $54 \div 39 \times 27 = 18$

(D) $63 \times 42 \div 84 = 21$

64. એક સાયકલસવાર સવારે 7:00 વાગ્યે આણંદથી નીકળે છે અને 11:00 વાગ્યે નડિયાદ પહોંચે છે. એક મોટરસાયકલસવાર સવારે 7:30 વાગ્યે નડિયાદથી નીકળે છે અને 11:00 વાગ્યે આણંદ પહોંચે છે. તેઓ રસ્તામાં કયા સમયે મળશે?
- (A) સવારે 9:02 વાગ્યે
(B) સવારે 9:04 વાગ્યે
(C) સવારે 9:06 વાગ્યે
(D) સવારે 9:08 વાગ્યે
65. અમિત અને રોહન નામના બે કામદારો એક બાંધકામ પ્રોજેક્ટ અનુક્રમે 18 દિવસ અને 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓએ સાથે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ 5 દિવસ પછી, રોહને જવું પડ્યું. અમિતે પછી કરણ નામના નવા કામદાર સાથે કામ ચાલુ રાખ્યું, અને તેઓએ બાકીનું કામ 4 દિવસમાં પૂર્ણ કર્યું. જો કરણ એકલો કામ કરે છે, તો તે કેટલા દિવસોમાં તે જ પ્રોજેક્ટનો 50% ભાગ પૂર્ણ કરી શકે છે?
- (A) 22 દિવસ
(B) 21 દિવસ
(C) 24 દિવસ
(D) 20 દિવસ
66. લેપટોપ A ની કિંમત લેપટોપ B ની કિંમત કરતાં 60% વધારે છે અને લેપટોપ B ની કિંમત લેપટોપ C ની કિંમત કરતાં 30% ઓછી છે. જો લેપટોપ A અને લેપટોપ C ની કિંમતો વચ્ચેનો તફાવત ₹ 300 હોય, તો લેપટોપ B ની કિંમત કેટલી છે?
- (A) ₹ 1400
(B) ₹ 1500
(C) ₹ 1600
(D) ₹ 1750
67. એક ફોટોમાં એક છોકરીને દેખાડીને, એક માણસે કહ્યું, 'તેણીના ભાઈની માતા એ મારા પિતાની એકમાત્ર દીકરી છે.' આ છોકરી તે માણસ સાથે કેવી રીતે સંબંધિત છે?
- (A) બહેન
(B) દીકરી
(C) ભત્રીજી
(D) પિતરાઈ ભાઈ
68. એક કાર શરૂઆતમાં પાર્કિંગ લોટમાં ઉત્તર-પશ્ચિમ તરફ મુખ કરીને ઊભી છે. પછી તે 90° જમણી તરફ (ઘડિયાળની દિશામાં) ફરે છે, ત્યારબાદ 180° ડાબી તરફ (ઘડિયાળની વિરુદ્ધ દિશામાં) ફરે છે અને અંતે તે જ દિશામાં (ઘડિયાળની વિરુદ્ધ દિશામાં) 45° વળે છે. કાર હવે કઈ દિશામાં મુખ કરીને ઊભી છે?
- (A) ઉત્તર-પશ્ચિમ
(B) દક્ષિણ-પશ્ચિમ
(C) ઉત્તર-પૂર્વ
(D) દક્ષિણ-પૂર્વ

69. સુરત બસ સ્ટેશનથી અમદાવાદ માટેની બસ દર અઢી કલાકે ઉપડે છે. સ્ટેશન પર જાહેરાત કરવામાં આવ્યું કે અમદાવાદ માટેની બસ 30 મિનિટ પહેલાં નીકળી ગઈ છે, અને આગામી બસ 19:00 વાગ્યે ઉપડશે. તો આ જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?
- (A) 17:30 વાગ્યે
(B) 17:10 વાગ્યે
(C) 17:20 વાગ્યે
(D) 17:00 વાગ્યે
70. રાહુલ એક શોપિંગ મોલમાં હતો, જ્યાં તેણે દાન માટે ભેટો ખરીદવાનું નક્કી કર્યું. તેણે ત્રણ ખરીદીઓ કરી, દરેક વખતે તેની પાસે બાકી રહેલા પૈસામાંથી અડધાથી થોડો વધારે ખર્ચ કર્યો. છેલ્લી ખરીદી પછી, તેની પાસે ફક્ત 1 રૂપિયો બાકી રહ્યો. રાહુલે કોઈપણ ખરીદી કરતા પહેલાં મૂળમાં કેટલા પૈસા હતા?
- (A) 36 રૂપિયા
(B) 42 રૂપિયા
(C) 48 રૂપિયા
(D) 52 રૂપિયા
71. એક ડિલિવરી સેવા દિલ્હીથી જયપુર માટે પાંચ અલગ અલગ રૂટ ચલાવે છે. જયપુરથી ભોપાલ માટે તેમની પાસે ચાર અલગ અલગ રૂટ છે અને ભોપાલથી ચેન્નાઈ માટે તેમની પાસે ત્રણ અલગ અલગ રૂટ છે. દિલ્હીથી ચેન્નાઈ સુધી કેટલા અલગ અલગ ડિલિવરી રૂટ ઉપલબ્ધ છે?
- (A) 20
(B) 60
(C) 12
(D) 30
72. જો " MISCELLANEOUS " શબ્દના અક્ષરોને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે, તો નવા ક્રમમાં જમણી બાજુથી ચોથા અક્ષર અને ડાબી બાજુથી ત્રીજા અક્ષરની સ્થિતિમાં શું તફાવત હશે?
- (A) 6
(B) 7
(C) 8
(D) 9
73. એક શાળાએ વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કર્યું. દુર્ભાગ્યવશ, કેમ્પ દરમિયાન 15 દિવસ સુધી દરરોજ વરસાદ પડ્યો. જો કે, જ્યારે પણ સવારે વરસાદ પડતો, ત્યારે વિદ્યાર્થીઓએ બપોરે બહારની પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો અને ઉલટું કુલ મળીને, વિદ્યાર્થીઓને 13 સ્પષ્ટ સવાર અને 14 સ્પષ્ટ બપોર મળી. સમર કેમ્પ કુલ કેટલા દિવસ ચાલ્યો?
- (A) 26
(B) 22
(C) 21
(D) 20

74. RBI ના કાર્યો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. RBI પાસે દેશના આંતરરાષ્ટ્રીય ચલણના દેશના ભંડોળની કસ્ટડી છે.
2. RBI કેન્દ્ર સરકારના તમામ નાણાકીય વ્યવહારો કરે છે પરંતુ રાજ્ય સરકારોના નહીં.
3. RBI શાખ નાણાંના પુરવઠાને નિયંત્રિત કરે છે.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 1 અને 3

(C) ફક્ત 2 અને 3

(D) 1, 2 અને 3

75. ભારતમાં GST વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. GST એ ઉત્પાદન આધારિત કર છે.

✓ 2. GST એ GST કાઉન્સિલ દ્વારા સંચાલિત થાય છે, જેના અધ્યક્ષ ભારતના નાણાપ્રધાન હોય છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

✓ (B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

76. નીચેનામાંથી કયું/કયાં શહેર/શહેરો નદીકિનારે આવેલું/આવેલાં નથી?

1. આગ્રા

2. પટણા

3. ભોપાલ

4. કોલકાતા

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

✓ (A) ફક્ત 3

(B) ફક્ત 2 અને 3

(C) ફક્ત 2 અને 4

(D) ફક્ત 1 અને 4

77. નીચે આપેલાં હિમાલયનાં શિખરોને માટે તેમની ઊંચાઈને આધારે ઉત્તરતા ક્રમની વિકલ્પ પસંદ કરો:

- (A) કાંચનજંઘા, મકાલુ, ધવલગિરિ, માઉન્ટ ગોડવિન ઓસ્ટીન
 (B) માઉન્ટ ગોડવિન ઓસ્ટીન, મકાલુ, ધવલગિરિ, કાંચનજંઘા
 (C) ધવલગિરિ, માઉન્ટ ગોડવિન ઓસ્ટીન, કાંચનજંઘા, મકાલુ
 (D) માઉન્ટ ગોડવિન ઓસ્ટીન, કાંચનજંઘા, મકાલુ, ધવલગિરિ

78. પૃથ્વીનાં વૃત્તો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પૃથ્વીના ગોળાને બરાબર બે ભાગમાં વહેંચતી આડી અલ્પનિક રેખાને વિષુવવૃત્ત કહે છે.
 2. વિષુવવૃત્તથી ધ્રુવો સુધી સમાંતર વૃત્તઓને રેખાંશવૃત્ત કહે છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

79. પૃથ્વીની ગતિના સંદર્ભે દિવસ-રાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. જૂનની 21મી તારીખે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબામાં લાંબો અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે.
 2. ડિસેમ્બરની 22મી તારીખે દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

80. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ક્રિકેટ મેચ લંડનમાં બપોરે બે વાગે શરૂ થાય છે તો ભારતમાં એ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

(A) સવારે 7:30

(B) સાંજે 7:30

(C) સાંજે 7:00

(D) સવારે 5:00

81. જૈવભૂરાસાયણિક ચક્રો અંગે નીચેના વિધાનો ધ્યાને લો:

1. નાઇટ્રોજન ચક્ર મુખ્યત્વે અજૈવિક પ્રક્રિયાઓ દ્વારા સંચાલિત થાય છે, જેમાં સૂક્ષ્મજીવોની ભાગીદારી નહિવત્ હોય છે.
2. ફોસ્ફરસ ચક્ર એક વાયુરૂપ ચક્ર છે, જેમાં વાતાવરણીય પરિવહન તેના વૈશ્વિક વિતરણ માટે મુખ્ય પદ્ધતિ છે.
3. સલ્ફર ચક્ર પર્યાવરણની રેડોક્સ સ્થિતિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે, જેમાં સલ્ફર વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓમાં અસ્તિત્વ ધરાવે છે.

ઉપર પૈકી કયું વિધાન સાચું છે?

- (A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) ફક્ત 3 (D) 1, 2 અને 3માંથી કોઈ નહીં

82. ખગોળશાસ્ત્ર અને અવકાશ સંશોધન અંગે નીચેના વિધાનો ધ્યાને લો:

1. ધૂમકેતુની પૂંછડી હંમેશાં સૂર્યથી દૂર તરફ નિર્દેશ કરે છે, પછી ભલે ધૂમકેતુની ગતિની દિશા ગમે તે હોય.
2. કાઇપર પટ્ટો એ સૌરમંડળનો એક પ્રદેશ છે જે મંગળ અને ગુરુની વચ્ચે સ્થિત છે, જેમાં મોટી સંખ્યામાં એસ્ટરોઇડ્સ છે.
3. કેસિની-હ્યુજેન્સ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ મંગળ ગ્રહ અને તેના ચંદ્રનો અભ્યાસ કરવાનો હતો.

ઉપર પૈકી કયું વિધાન સાચું છે?

- (A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) ફક્ત 3 (D) 1, 2 અને 3માંથી કોઈ નહીં

83. સમુદ્રશાસ્ત્ર અને આબોહવા પ્રણાલીઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લો:

1. ગલ્ફ સ્ટ્રીમ એક ગરમ, શક્તિશાળી મહાસાગરીય પ્રવાહ છે જે પશ્ચિમ યુરોપની આબોહવાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે.
2. વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થવાને કારણે થતું સમુદ્રી એસિડિફિકેશન, દરિયાઈ જીવોના કેલ્શિયમ કાર્બોનેટના શંખલાં (shells) અને હાડપિંજરના વિસર્જન તરફ દોરી જાય છે.
3. ઊંડા સમુદ્રી પ્રવાહો મુખ્યત્વે પવનની પેટર્ન દ્વારા ચલાવવામાં આવે છે અને વૈશ્વિક ગરમીના વિતરણ પર તેની અસર નહિવત્ હોય છે.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

- (A) ફક્ત 1 અને 2 (B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3 (D) 1, 2 અને 3

84. ફૂગ અને રોગપ્રતિકારક તંત્રની પદ્ધતિઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લો:
1. એન્ટિબોડીઝ તમામ પ્રકારના રોગકારકો સામે તાત્કાલિક, વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે.
 2. ફૂગ એ યુકેરીયોટિક સજીવો છે જેમાં કોષ દિવાલો મુખ્યત્વે ચિટિનથી બનેલી હોય છે.
 3. પૂરક પ્રણાલી એન્ટિબોડીઝ અને ફેગોસાયટીક કોશિકાઓની સૂક્ષ્મજીવાણુઓ અને ક્ષતિગ્રસ્ત કોશિકાઓને સાફ કરવાની ક્ષમતાને વધારે છે, બળતરાને પ્રોત્સાહન આપે છે અને રોગકારકના પ્લાઝ્મા પટલ પર હુમલો કરે છે.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

- (A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3

85. તરંગ ગુણધર્મો અંગે નીચેના વિધાનો ધ્યાને લો:

1. વિદ્યુતચુંબકીય તરંગો શૂન્યાવકાશમાંથી પ્રસારિત થઈ શકે છે.
2. યાંત્રિક તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અને 2 બંને
(D) બંનેમાંથી એક પણ નહિ

86. ભારતમાં માહિતી અને સંચાર તકનીકી પહેલ અંગે નીચેના વિધાનો ધ્યાને લો:

1. નેશનલ ક્વોન્ટમ મિશનનો હેતુ ક્વોન્ટમ તકનીકોને આગળ વધારવાનો છે અને તેણે IISc બેંગલુરુ અને IIT જેવી અગ્રણી સંસ્થાઓમાં થિમેટિક હબ્સ (T-Hubs) સ્થાપિત કર્યા છે.
2. નેશનલ એકેડેમિક ડિપોઝિટરી શૈક્ષણિક પુરસ્કારોને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા અને ચકાસવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે સરળ એક્સેસની સુવિધા આપે છે અને બનાવટી પ્રમાણપત્રોનું જોખમ ઘટાડે છે.
3. સ્કીલ ઇન્ડિયા ડિજિટલ હબ (SIDH) એ એક સરકારી પહેલ છે જે વ્યક્તિઓને લેપટોપ અને ડિજિટલ ઉપકરણો ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

- (A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3

G

કચ. ભારતના અવકાશ ક્ષેત્રમાં તાજેતરના વિકાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો:

1. IN-SPACe, 2020 માં સ્થપાયેલ, ભારતમાં અવકાશ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને અધિકૃત કરવા માટે સિંગલ-વિન્ડો એજન્સી તરીકે કાર્ય કરે છે.
2. ગગનયાન મિશન, જે 2025 માટે સુનિશ્ચિત થયેલ છે, તેનો હેતુ ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનો છે, જે લાંબા ગાળાના માનવ અવકાશ ઉડાન મિશન માટે ભારતને સક્ષમ બનાવશે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

☒ (B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

કચ. નીચે આપેલાં રચયિતા અને દેશભક્તિનાં ગીતોના જોડકાંને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો:

રચયિતા

દેશભક્તિ ગીત

1. ઇકબાલ

a. નન્ના મુન્ના રાહી હું દેશકા સિપાહી હું

2. શકીલ બદાયુની

b. દિલ દિયા હૈ જાન ભી દેંગે, અય વતન તેરે લિયે,

3. આનંદ બક્ષી

c. મેરા મુલ્ક, મેરા દેશ, મેરા યે વતન,

4. જાવેદ અખ્તર

d. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા

	1	2	3	4
(A)	d	b	c	a
☒ (B)	c	a	d	b
(C)	b	d	a	c
(D)	d	a	b	c

૪૫. ભારતનું પરમાણુ સસ્ત્ર સિદ્ધાંત (Nuclear Doctrine) વ્યૂહાત્મક પ્રતિરોધ (strategic deterrence) અને પરમાણુ શસ્ત્રોના જવાબદાર ઉપયોગ પર આધારિત છે.

આ સંદર્ભમાં નીચેની નીતિ-વિગત જોડીઓ ધ્યાને લો:

૧. પ્રથમ ઉપયોગ નહીં (No First Use): ભારત પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે નહીં સિવાય કે તેના પર પ્રથમ પરમાણુ શસ્ત્રોથી હુમલો કરવામાં આવે.
૨. લવચીકપ્રતિભાવ રણનીતિ (Flexible Response Strategy): જો ભારતને નિકટવર્તી પરમાણુ મતરો દેખાય તો ભારત પૂર્વ-અસરકારક સ્ત્રાવકમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો અધિકાર અનામત રાખે છે.
૩. વિશાળ બદલો (Massive Retaliation): ભારત અસ્વીકાર્ય નુકસાન પહોંચાડવા માટે મોટા પાયે વળતો હુમલો સાથે કોઈપણ પરમાણુ હુમલાનો જવાબ આપશે.
૪. વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્ર સિદ્ધાંત (Tactical Nuclear Weapon Doctrine): ભારતે પરંપરાગત યુદ્ધમાં મર્યાદિત-પાયે સૈન્ય ઉપયોગ માટે યુદ્ધભૂમિ પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા છે અને જમાવ્યા છે.

ઉપરોક્ત નીતિ-વિગત જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?

- (A) ફક્ત ૧ અને ૨
- (B) ફક્ત ૧ અને ૩
- (C) ફક્ત ૩ અને ૪
- (D) ફક્ત ૨ અને ૪

૪૬. ભારતના પરમાણુ રિએક્ટર અંગે નીચેના વિધાનો ધ્યાને લો:

૧. કલપાક્રમ ખાતેનું ભારતનું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) સંપૂર્ણ રીતે કાર્યરત છે અને હાલમાં રાષ્ટ્રીય ગ્રીડને વીજળી પૂરી પાડે છે.
૨. ભારતની પરમાણુ શક્તિ વ્યૂહરચના ધોરણમ આધારિત રિએક્ટરને પ્રાથમિકતા આપતી નથી અને ભવિષ્યના વિસ્તરણ માટે યુરેનિયમ આધારિત રિએક્ટર પર જ આધાર રાખે છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત ૧
- (B) ફક્ત ૨
- (C) ૧ અને ૨ બંને
- (D) બંનેમાંથી એક પણ નહિ

91. ભારતની આબોહવા અને આપત્તિ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લો:
1. નેશનલ એડેપ્ટેશન ફંડ ફોર ક્લાઈમેટ ચેન્જ (NAFCC) આબોહવા-સ્થિતિસ્થાપક (ક્લાઈમેટ રેઝિલિઅન્સ) માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે.
 2. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ (NAPCC) માં આઠ મુખ્ય મિશનનો સમાવેશ થાય છે, જેમાં નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અને નેશનલ વોટર મિશનનો સમાવેશ થાય છે.
 3. ભારતનો સ્ટેટ એક્શન પ્લાન્સ ઓન ક્લાઈમેટ ચેન્જ (SAPCCs) કેન્દ્ર સરકાર તરફથી કોઈપણ માર્ગદર્શિકા અથવા સંકલન વિના રાજ્ય સરકારો દ્વારા સ્વતંત્ર રીતે ઘડવામાં આવે છે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1

92. બાયોટેકનોલોજીના સંદર્ભમાં, નીચેની રજૂઆતો અને તેમના લક્ષ્ય ક્ષેત્રોની જોડી ધ્યાને લો:
1. વ્હાઈટ બાયોટેકનોલોજી - બાયોફ્યુઅલ અને એન્ઝાઇમ ઉત્પાદન સહિત ઔદ્યોગિક એપ્લિકેશન સંબંધિત છે.
 2. રેડ બાયોટેકનોલોજી - જીન થેરાપી અને રસી વિકાસ સહિત દવા અને માનવ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે.
 3. ગ્રીન બાયોટેકનોલોજી - મુખ્યત્વે પર્યાવરણીય જાળવણી અને દૂષક દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
 4. બ્લુ બાયોટેકનોલોજી - દરિયાઈ જીવોમાંથી બાયોએક્ટિવ સંયોજનો સહિત દરિયાઈ અને જળચર બાયોટેકનોલોજી સાથે સંકળાયેલ છે.

ઉપરોક્ત પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે મેળ ખાય છે?

- (A) ફક્ત 2 અને 3
(B) ફક્ત 1, 2 અને 4
(C) ફક્ત 1, 3 અને 4
(D) ફક્ત 2, 3 અને 4

93. નેનોટેકનોલોજીના સંદર્ભમાં, ક્વોન્ટમ અસરો નેનોસ્કેલ પર નોંધપાત્ર બનવાનું પ્રાથમિક કારણ શું છે?
- (A) નેનોપાર્ટિકલ્સમાં જથ્થાબંધ (બલ્ક) સામગ્રીની તુલનામાં ઓછી ઘનતા હોય છે, જે તેમના યાંત્રિક ગુણધર્મોમાં ફેરફાર કરે છે.
- (B) "સપાટી વિસ્તાર અને કદનો ગુણોત્તર" ઘટે છે, જે રાસાયણિક સ્થિરતામાં વધારો કરે છે.
- (C) ઈલેક્ટ્રોન અને અણુઓનું વર્તન ક્લાસિકલ ભૌતિકશાસ્ત્રને બદલે ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા સંચાલિત થાય છે.
- (D) નેનોપાર્ટિકલ્સ નબળા આંતરઆણ્વિક બળો ધરાવે છે, જે તેમને વધુ પ્રતિક્રિયાશીલ બનાવે છે.

94. 'સ્ટમ્પ' પુસ્તક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આ પુસ્તક મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર આધારિત છે.

2. તેમાં 2011ના વર્લ્ડ કપ વિશે જાણકારી છે.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

☒ (C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

95. તાજેતરમાં આઈસીસીએ અમ્પાયર્સની એલિટ પેનલમાં નીચેનામાંથી કયાં ફેરફાર કર્યા છે?

1. માઇકલ ગોફ અને જોએલ વિલ્સનને બહાર કરાયા છે.

2. અલ્લાહઉદ્દીન પાલેકર અને એલેક્સ વાર્કને બહાર કરાયા છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ



96. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળના પગલાં વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ અભિયાન હેઠળ ભારતે પહેલું સ્વદેશી એમઆરઆઈ મશીન વિકસાવ્યું છે.
 2. જે ઓક્ટોબર સુધીમાં ટ્રાયલ માટે એઇમ્સ રાજકોટમાં સ્થાપિત કરવામાં આવશે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

97. પેરા તીરંદાજ પાયલ નાગ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પાયલ નાગે હાલમાં જયપુરમાં નેશનલ પેરા તીરંદાજ હરિફાઇ (ચેમ્પિયનશિપ) જીતી હતી.
2. તે દુનિયાની એક માત્ર તીરંદાજ છે કે જેને હાથ-પગ બંને નથી.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ

98. સાંસદોના પગાર વધારો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં 25%ના વધારાની અધિસૂચના જાહેર કરી છે.
2. આ વધારો 1લી એપ્રિલ 2023થી લાગુ થશે.
3. આ સૂચના સંસદીય કાર્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવી છે.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 2 અને 3

(C) ફક્ત 1 અને 3

(D) 1, 2 અને 3

99. કોલેજમાં આપઘાત રોકવા માટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવાના સુપ્રીમના આદેશ પ્રમાણે નીચેનામાંથી કયાં વિભાગના સચિવો તેના સભ્યો છે?

1. ઉચ્ચ શિક્ષણ વિભાગ
 2. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
 3. કાયદા વિભાગ
 4. મહિલા સશક્તિકરણ અને બાળવિકાસ મંત્રાલય
- નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

- (A) ફક્ત 1
 (B) ફક્ત 1 અને 4
 (C) ફક્ત 1 અને 3
 (D) 1, 2, 3 અને 4

100. ભારતમાં સોનાની ખાણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મધ્યપ્રદેશના સુંદરગઢ, નવરંગપુર, અંગુલ, કોરાપુટ અને કર્ણોઝરમાં સોનાનો ભંડાર મળ્યો છે.
 2. સરકાર હવે દેવગઢમાં પહેલી વાર સોનાની ખાણની હરાજી કરશે.
- ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

- (A) ફક્ત 1
 (B) ફક્ત 2
 (C) 1 અને 2 બંને
 (D) બંનેમાંથી એક પણ નહિ